

DD-105

December-2023

B.Com., Sem.-III**CC-205 : Statistics – III**

(New)

Time : 2½ Hours]**[Max. Marks : 70]****Instructions :** (1) All questions carry equal marks.

(2) Simple calculator can be used.

(3) Figures to the right indicate full marks of the question.

1. (i) State working rules of limit of a function. 7(ii) Find the limit for the following : (any two) 7

(a) $\lim_{x \rightarrow 0} \frac{5x^3 + 9x^2 - 15x}{4x^2 + 7x}$

(b) $\lim_{x \rightarrow 3} \frac{x^3 - 27}{\sqrt[3]{x} - \sqrt[3]{3}}$

(c) $\lim_{x \rightarrow 3} \frac{\sqrt{x+6} - 3}{x - 3}$

(d) $\lim_{x \rightarrow \infty} \frac{8x^2 + 11x - 3}{5x^2 + 3x - 6}$

OR1. (i) Explain the continuity of a function $x = a$ and for which value of x , $f(x)$ is discontinuous? 7

$$f(x) = \frac{x^2 - 7x + 12}{x^2 - 9x + 20}$$

(ii) Find the limit for the following : (any two) 7

(a) $\lim_{x \rightarrow 0} 2 + \frac{3}{4 + \frac{5}{x}}$

(b) $\lim_{x \rightarrow -2} \frac{x^3 + 8}{x^2 + 8x + 12}$

(c) $\lim_{x \rightarrow \infty} \frac{1 + 2 + 3 + \dots + n}{(x + 3)(x + 4)}$

(d) $\lim_{x \rightarrow -7} \frac{x^2 + 11x + 28}{x^2 + 5x - 14}$

2. (i) Explain the following terms : (any three)

7

- (a) Sample Space
- (b) Complementary Events
- (c) Union Event
- (d) Conditional Probability

, (ii) Three persons x , y and z aims a target. The probability of their hitting the target is

$\frac{2}{3}$, $\frac{3}{4}$ and $\frac{4}{5}$ respectively. Find the probability that the target will be hit.

7

OR

2. (i) If $P(A \cup B) = 0.80$, $P(A \cap B) = 0.15$ and $P(A) = 2 P(B)$, then find the value of $P(A)$, $P(B)$, $P(A/B)$ and $P(A' \cap B')$.

7

(ii) Three machines M_1 , M_2 and M_3 produces 20%, 50% and 30% of items daily in a factory. The percentage of defective items of these machines are respectively 3%, 4% and 5%. An item is taken at random from the production and is found to be defective. Find the probability that it is produced by machine M_1 .

7

3. (i) Define Mathematical Expectation. State the characteristics of the Mathematical Expectation.

7

(ii) The probability distribution of a discrete random variable x is as follows :

7

x_i	-1	0	1	2	3
$P(x_i)$	$2P$	$\frac{3}{10}$	$\frac{1}{10}$	$2P$	$\frac{4}{10}$

Find the value of P , Mean and Variance.

OR

3. (i) Two tickets are taken at random from 6 tickets numbered from 10 to 15. Find the expected value of the sum obtained on the two tickets selected. Also find its variance.

7

(ii) The values of random variable x are 11, 15, 10, 8 and 16. Find first four central moments and also find β_1 and β_2 .

7

4. (i) State probability function of a Negative Binomial Distribution. State its properties and uses. 7

- (ii) Thirty percent of potatoes are stale in a lot of potatoes. A person requires 5 good potatoes. Find probability of getting 5th good potato when he inspects 9th potato. Also find mean and variance of number of failures before getting 5th good potato. 7

OR

4. (i) The probability that a person can hit a target in any trial is 0.6. When he hits the target 4th time, he gets a prize. Find the probability that he will require 6th or 7th trial to win the prize. 7

- (ii) A die is thrown and an even number is regarded as success. Find the probability that more than 3 trials will be required before getting first success. 7

5. Answer the following : (any seven) 14

(1) What is the value of $\lim_{x \rightarrow a} \frac{x^n - a^n}{x - a}$?

(2) For what values of x the function $f(x) = \frac{2x^3 + 5x - 11}{x^2 - 9}$ is discontinuous ?

(3) Write the formula of rule of addition for 3 events.

(4) If $P(A) = 2 P(B) = P(A/B) = 0.6$, then find $P(A - B)$.

(5) Write properties of probability distribution.

(6) If $E(x) = 3.5$ and $V(x) = 15$, then find $E(x^2)$.

(7) If x and y are two independent variables and $E(x) = 5$, $E(y) = 3$, $V(x) = 10$ and $V(y) = 4$, then find $V(2x - 3y)$.

4. (i) State probability function of a Negative Binomial Distribution. State its properties and uses. 7

- (ii) Thirty percent of potatoes are stale in a lot of potatoes. A person requires 5 good potatoes. Find probability of getting 5th good potato when he inspects 9th potato. Also find mean and variance of number of failures before getting 5th good potato. 7

OR

4. (i) The probability that a person can hit a target in any trial is 0.6. When he hits the target 4th time, he gets a prize. Find the probability that he will require 6th or 7th trial to win the prize. 7

- (ii) A die is thrown and an even number is regarded as success. Find the probability that more than 3 trials will be required before getting first success. 7

5. Answer the following : (any seven) 14

(1) What is the value of $\lim_{x \rightarrow a} \frac{x^n - a^n}{x - a}$?

(2) For what values of x the function $f(x) = \frac{2x^3 + 5x - 11}{x^2 - 9}$ is discontinuous ?

(3) Write the formula of rule of addition for 3 events.

(4) If $P(A) = 2 P(B) = P(A/B) = 0.6$, then find $P(A - B)$.

(5) Write properties of probability distribution.

(6) If $E(x) = 3.5$ and $V(x) = 15$, then find $E(x^2)$.

(7) If x and y are two independent variables and $E(x) = 5$, $E(y) = 3$, $V(x) = 10$ and $V(y) = 4$, then find $V(2x - 3y)$.

- (8) State the formulae of skewness and kurtosis.
- (9) State mean and variance of geometric distribution.
- (10) In a negative binomial distribution, mean and S.D. are 12 and $\sqrt{48}$ respectively, then find its parameters.
- (11) If a coin and a die is tossed simultaneously, then obtain its sample space.
- (12) If $\lim_{x \rightarrow -5} 5x + K = 10$, then find K.
-

@geniusguruji

Seat No. : _____

DD-105

December-2023

B.Com., Sem.-III

CC-205 : Statistics – III

(New)

Time : 2½ Hours]

[Max. Marks : 70]

- સૂચનાઓ : (1) બધા જ પ્રશ્નોના ગુણ સરખા છે.
(2) સાદું ગણનયંત્ર વાપરવાની છૂટ છે.
(3) જમાણી બાજુ દશવિલ અંક પૂરા ગુણ દશવિ છે.

1. (i) વિધેયના લક્ષના કાર્ય નિયમો જણાવો. 7

(ii) નીચેનાના લક્ષ શોધો : (કોઈપણ બે)

$$(a) \lim_{x \rightarrow 0} \frac{5x^3 + 9x^2 - 15x}{4x^2 + 7x}$$

$$(b) \lim_{x \rightarrow 3} \frac{x^3 - 27}{\sqrt{x} - \sqrt{3}}$$

$$(c) \lim_{x \rightarrow 3} \frac{\sqrt{x+6} - 3}{x - 3}$$

$$(d) \lim_{x \rightarrow \infty} \frac{8x^2 + 11x - 3}{5x^2 + 3x - 6}$$

અથવા

1. (i) વિધેયની $x = 2$ આગળની સાતત્યતા સમજાવો અને જો $f(x) = \frac{x^2 - 7x + 12}{x^2 - 9x + 20}$ હોય તો x ની એવી કિમતો શોધો કે જે માટે $f(x)$ અસતત થાય. 7

(ii) નીચેનાના લક્ષ શોધો : (કોઈપણ બે)

7

$$(a) \lim_{x \rightarrow 0} 2 + \frac{3}{4 + \frac{5}{x}}$$

$$(b) \lim_{x \rightarrow -2} \frac{x^3 + 8}{x^2 + 8x + 12}$$

$$(c) \lim_{x \rightarrow \infty} \frac{1 + 2 + 3 + \dots + n}{(x+3)(x+4)}$$

$$(d) \lim_{x \rightarrow -7} \frac{x^2 + 11x + 28}{x^2 + 5x - 14}$$

2. (i) નીચેના પદો સમજાવો : (કોઈપણ ત્રણ) 7

- (a) નિદર્શાવકાશ
- (b) પૂરક ઘટનાઓ
- (c) યોગ ઘટના
- (d) શરતી સંભાવના

(ii) ત્રણ વ્યક્તિ x, y અને એક નિશાન તાકવામાં આપવામાં આવે છે. તેમની નિશાન તાકવાની સંભાવના અનુક્રમે $\frac{2}{3}, \frac{3}{4}$ અને $\frac{4}{5}$ છે તો નિશાન વીધવાની સંભાવના મેળવો. 7

અથવા

2. (i) જો $P(A \cup B) = 0.80, P(A \cap B) = 0.15$ અને $P(A) = 2 P(B)$ હોય તો $P(A), P(B), P(A/B)$ અને $P(A' \cap B')$ શોધો. 7

(ii) એક ફેફટરીમાં ત્રણ મશીનો M_1, M_2 અને M_3 કુલ ઉત્પાદનના 20%, 50% અને 30% વस્તુઓ દુરોજ બનાવે છે. તે મશીનો અનુક્રમે 3%, 4% અને 5% ખામીવાળી વસ્તુઓ બનાવે છે. ઉત્પાદન પ્રક્રિયામાંથી યદૃચ્છ રીતે એક વસ્તુ લેવામાં આવે છે જે ખામીવાળી જણાય છે, તો તે વસ્તુ મશીન M_1 દ્વારા ઉત્પાદિત થઈ હોય તેની સંભાવના શોધો. 7

3. (i) ગાણિતીય અપેક્ષાની વ્યાખ્યા આપો અને તેના ગુણધર્મો જણાવો. 7

(ii) એક અસતત યદૃચ્છ ચલ ર્ણું સંભાવના વિતરણ નીચે પ્રમાણે છે : 7

x_i	-1	0	1	2	3
$P(x_i)$	$2P$	$\frac{3}{10}$	$\frac{1}{10}$	$2P$	$\frac{4}{10}$

P ની કિંમત શોધો તેમજ મધ્યક અને વિચરણ શોધો.

અથવા

3. (i) 10થી 15 નંબરવાળી 6 ટિકિટોમાંથી કોઈપણ બે ટિકિટો યદૃચ્છ રીતે પસંદ કરવામાં આવે છે તો પસંદ થયેલ ટિકિટો પરના નંબરના સરવાળાની અપેક્ષિત કિંમત અને વિચરણ શોધો. 7

(ii) એક યાદચિક ચલ x ની કિંમતો 11, 15, 10, 8 અને 16 છે. તો પ્રથમ ચાર કેન્દ્રીય પ્રધાતો મેળવો તેમજ β_1 અને β_2 શોધો. 7

4. (i) ઋણ ક્રિપદી વિતરણનું સંભાવના વિધેય જણાવો. તેના ગુણધર્મો તથા ઉપયોગો જણાવો. 7

(ii) બટાકાના એક જથ્થામાં 30 ટકા બટાકા ખરાબ હતા. એક વ્યક્તિને 5 સારા બટાકા જોઈએ છે તો જ્યારે તે 9મું બટાકું તપાસતાં 5મું બટાકું સારું હોય તેની સંભાવના શોધો. આ ઉપરાંત 5મું બટાકું સારું મળે તે પહેલાંની નિષ્ણળતાનાં મધ્યક અને વિચરણ મેળવો. 7

અથવા

4. (i) એક વ્યક્તિ કોઈપણ પ્રયત્નમાં નિશાન વીધી શકે તેની સંભાવના 0.6 છે, જ્યારે તે ચોથી વખત નિશાન વીધે છે ત્યારે તેને ઈનામ મળે છે તો ઈનામ મેળવવા માટે તેને 6 અથવા 7 પ્રયત્નો કરવા પડે તેની સંભાવના શોધો. 7

(ii) પાસો ઉછાળતાં નંબર બેકી મળે તેને સફળતા ગાળવામાં આવે તો પ્રથમ સફળતા મેળવવા માટે 3 થી વધુ પ્રયત્ન કરવા પડે તેની સંભાવના શોધો. 7

5. નીચેનાના જવાબ આપો : (કોઈપણ સાત)

14

(1) $\lim_{x \rightarrow a} \frac{x^n - a^n}{x - a}$ ની કિંમત શું છે ?

(2) વિધેય $f(x) = \frac{2x^3 + 5x - 11}{x^2 - 9}$ ના કયાં બિંદુઓ આગળ અસતત છે ?

(3) ત્રણ ઘટનાઓ માટે સંભાવનાનો સરવાળાનો નિયમ લખો.

(4) જો $P(A) = 2 P(B) = P(A/B) = 0.6$ હોય તો $P(A - B)$ શોધો.

(5) સંભાવના વિતરણના ગુણધર્મો જણાવો.

(6) જો $E(x) = 3.5$ અને $V(x) = 15$ તો $E(x^2)$ શોધો.

- (7) જો x અને y નિરપેક્ષ યાદચિહ્ન ચલો હોય અને $E(x) = 5$, $E(y) = 3$, $V(x) = 10$ અને $V(y) = 4$ હોય તો $V(2x - 3y)$ શોધો.
- (8) વિષમતા અને ઘંટાકારતાના સૂત્રો જણાવો.
- (9) ગુરુણોત્તર વિતરણનાં મધ્યક અને વિચરણ જણાવો.
- (10) એક પ્રથમ છ્રિપદી વિતરણનાં મધ્યક અને પ્ર.વિ. અનુકૂળે 12 અને $\sqrt{48}$ છે, તો તેના પ્રાચલો શોધો.
- (11) એક સિક્કો અને એક પાસો એક સા�ે ઉછાળતાં મળતો નિદર્શાવકાશ લખો.
- (12) $\lim_{x \rightarrow -5} 5x + K = 10$ હોય તો K શોધો.

@geniusguruji